

સુરત શહેર વિસ્તારમાં ઘરમાં ઘુસી વિધી કરવાના બહાને ચોરી, છળકપટથી મેળવી લેતી મહીલા આરોપીઓને સોના ચાંદીના દાગીના કિ.૧૦,૪૧,૭૨૧/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી, ડીડોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ.

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય રહીશોને ટાર્ગેટ કરી, ફાળો માંગવાના બહાને મકાનોમાં જઈ સ્ત્રીઓને વિશ્વાસમાં લઈને, "તમારા ઘરમાં મેલી શક્તિનો વાસ છે" તેવી વાતો કરીને માથાના ભાગે હાથ ફેરવીને તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડા રકમ અને કપડા છળકપટથી કાઢાવી લેતી હોય તેવી મહીલા ગેંગ સક્રીય થયેલ હોય, જે અનુસંધાને ભુતકાળમાં બનેલ બનાવ સંબંધે સક્રીય મહિલા ગેંગને પકડી પાડવા ડીડોલી પો.સ્ટે.ના પો.સ.ઈ. શ્રી આર.પી.દરજી. તથા સાથેના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અ.હે.કો. વિરેનભાઈ જમુભાઈ તથા અ.હે.કો. મંગળાબેન રાજેશભાઈ તથા અ.હે.કો. નવલસંગ ગોવિંદસંગ નાઓને બાતમીના આધારે ચાર મહિલા આરોપીઓને સોના ચાંદીના દાગીના તથા સાડીઓ સાથે પકડી પાડી, સીઆરપીસી ક.૪૧(૧)ડી મુજબ તા.૨૫/૨/૨૦૨૦ના ક.૧૩/૪૫ વાગે અટક કરેલ છે.

પકડાયેલ મહીલા આરોપીઓના નામ સરનામા:-

(૧) ફરજાના W/O ભંક્ર નસીબ અહમદ કહુ અંસારી ઉ.વ. ૩૫ રહે. પ્લોટ ૯ થી ૧૪ બીજા માળે પ્રકાશનગર આસપાસ દાદાના મંદિરની સામે સંજયભાઈ રબારીના મકાનમાં ભાડેથી ગોડાદરા લિંબાયત, સુરત મુળવતન-સુકનાલ સુવરી રામપુરા તા.કેરાકતપુર બજાર થાના-સોલાપુર, જી.વારાણસી (ઉ.પ્ર.) (૨) સહોદરા ઉર્ફે ખૈરુનિશા તે રસીદ અબ્દુલ કલ્લુ મુરલી અંસારીની પત્ની ઉ.વ.૫૭ રહે. પ્લોટ નં. ૯ થી ૧૪ બીજા માળે પ્રકાશનગર આસપાસ દાદાના મંદિરની સામે સંજયભાઈના રબારીના મકાનમાં ભાડેથી ગોડાદરા, લિંબાયત, સુરત મુળવતન-દીઈપુર, ધસૌના તા.ચંદવત થાના- સોલાપુર (ઉ.પ્ર.) (૩) ગોહું તે નુર મહમદ ભોનુ અંસારીની પત્ની ઉ.વ.૩૭ રહે. પ્લોટ નં.૮૧, પહેલા માળે વિશાલભાઈ મકાનમાં ભાડેથી, લક્ષમણનગર, આસપાસ મંદિર પાસે ગોડાદરા, લિંબાયત, સુરત. મુળવતન-બુવારી ખુર્દ તા.પીંદણેચ થાના-બડાગાંવ, જી.વારાણસી (ઉ.પ્ર.) (૪)નાઝમા ઉર્ફે મીના W/O ગુલ મહોમદ તેઢઈ અંસારી ઉ.વ. ૪૦ રહે. પ્લોટ નં. ૮૧, વિસાલભાઈ મકાનમાં ભાડેથી, લક્ષમણનગર, આસપાસ મંદિરની બાજુમાં, લિંબાયત, સુરત. મુળ રહે. સ્વરીરામપુરા તા.કિરાકટ થાના જલાલપુર જી. જોનપુર (ઉ.પ્ર.)

કબજે કરેલ મુદ્દામાલ :- અલગ અલગ સોનાના-ચાંદીના દાગીનાઓ કિ. રૂ.૧૦,૪૧,૭૨૧/-સાડીઓ કિ.રૂ. ૬૦૦૦/- કુલ્લે કબજે કરેલ મુદ્દામાલની કિ.રૂ.૧૦,૪૭,૭૨૧/- જેઓ તમામ મહીલાઓ મુસ્લીમ હોવા છતા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ મહીલાઓને જ ટાર્ગેટ બનાવે છે. વીધી બાબતે કોઈને જણાવશે તો પતિ/ બાળકો મરી જવાની ધમકીથી બનાવ ડીકલેર થતા નથી.

ડીટેક્ટ કરેલ ગુનાઈની વિગત:-(૧) ડીડોલી પોલીસ સ્ટેશન I ગુ.ર.નં. ૨૪૪/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૩૨૮, ૧૨૦(બી) મુજબ (૨) પલસાણા પોલીસ સ્ટેશન A પાર્ટ ૧૧૨૧૪૦૪૬૨૦૦૧૪૦ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ (૩) પાંડેસરા પોલીસ સ્ટેશન A પાર્ટ ૧૧૨૧૦૦૨૫૨૦૦૬૯૬ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ તથા બીજા ૭૦ જેટલા ગુન્હાઓ શોધવાની શક્યતા છે.